

પ્રજ્ઞા હોમ લર્નિંગ આયોજન

માસ-ઓક્ટોબર ૨૦૨૦

| તારીખ | વાર | ધોરણ | વિષય | તાસ | એકમ | એકમ નું નામ |
|------------|----------|------|---------|-----|---------|--------------------------------------|
| 03/10/2020 | શનિવાર | 1 | ગણિત | 9 | 2 | ૧ થી ૫ સુધીની સંખ્યાઓ |
| 03/10/2020 | શનિવાર | 2 | ગણિત | 9 | 16 | જૂથમાં ગણતરી (ભાગ -૪) |
| 05/10/2020 | સોમવાર | 1 | ગુજરાતી | 10 | 1,2 | પુનરાવર્તન(એકમ ૧-૨ ભાગ ૨) |
| 05/10/2020 | સોમવાર | 2 | ગુજરાતી | 10 | 1 થી 11 | પુનરાવર્તન (ભાગ-૨) |
| 06/10/2020 | મંગળવાર | 1 | ગણિત | 10 | 2 | ૧ થી ૫ સુધીની સંખ્યાઓ (ભાગ-૪) |
| 06/10/2020 | મંગળવાર | 2 | ગણિત | 10 | 17 | તમે કેટલું વજન ઊંચકી શકો છો ?(ભાગ ૧) |
| 09/10/2020 | શુક્રવાર | 1 | ગુજરાતી | 11 | 1 થી 3 | પુનરાવર્તન(એકમ ૧થી ૩ ભાગ ૩) |
| 09/10/2020 | શુક્રવાર | 2 | ગુજરાતી | 11 | 12 | બે મિત્રો (ભાગ -૧) |
| 10/10/2020 | શનિવાર | 1 | ગણિત | 11 | 3 | ૬ થી ૯ સુધીની સંખ્યાઓ (ભાગ ૧) |
| 10/10/2020 | શનિવાર | 2 | ગણિત | 11 | 17 | તમે કેટલું વજન ઊંચકી શકો છો ?(ભાગ ૨) |
| 12/10/2020 | સોમવાર | 1 | ગુજરાતી | 12 | 4 | બે બિલાડી અને વાંદરો (ભાગ ૧) |
| 12/10/2020 | સોમવાર | 2 | ગુજરાતી | 12 | 12 | બે મિત્રો (ભાગ -૨) |
| 13/10/2020 | મંગળવાર | 1 | ગણિત | 12 | 3 | ૬ થી ૯ સુધીની સંખ્યાઓ (ભાગ ૨) |
| 13/10/2020 | મંગળવાર | 2 | ગણિત | 12 | 17 | તમે કેટલું વજન ઊંચકી શકો છો ?(ભાગ ૩) |